



Seat No. : _____

NN-108

November-2025

B.A., Sem.-III (NEP)

DSC-C-232T (Major) : Home Science

(Women Empowerment & Personality Development)

Time : 1:00 Hour]

[Max. Marks : 25

1. સ્ત્રીઓને રક્ષણ આપતા જુદા-જુદા કાયદાઓ વિશે માહિતી આપો. 10
અથવા
1. સ્ત્રીઓના વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસમાં હોમસાયન્સ વિષયનો ફાળો સમજાવો. 10
2. શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં શારીરિક કસરતોના પ્રકારો તથા મહત્ત્વ વિશે માહિતી આપો. 10
અથવા
2. શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થી અને શિક્ષક તરીકેના શિષ્ટાચાર સમજાવો. 10
3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો : (કોઈપણ પાંચ) 5
 - (1) જુદી-જુદી એરોબિક કસરતો જણાવો.
 - (2) ત્વચાના પ્રકારો જણાવો.
 - (3) વ્યક્તિત્વ વિકાસ એટલે શું ?
 - (4) સ્ત્રી સશક્તિકરણના જુદા-જુદા ક્ષેત્રો જણાવો.
 - (5) પર્સનલ ગ્રૂમિંગના કોઈપણ ત્રણ પાસાઓ જણાવો.
 - (6) દહેજ પ્રતિબંધ અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો ?

Seat No. : _____

NN-108

November-2025

B.A., Sem.-III (NEP)

DSC-C-232T (Major) : Home Science

(Women Empowerment & Personality Development)

Time : 1:00 Hour]

[Max. Marks : 25

1. Give information about different laws that protect women. **10**

OR

1. Explain the contribution of Home Science subject in the personal and professional development of women. **10**

2. Give information about the types and importance of physical exercises in physical and mental health. **10**

OR

2. Explain the etiquette of being a student and a teacher in an educational institution. **10**

3. Answer the following questions in one sentence : (Any **five**) **5**

(1) Name different aerobic exercises.

(2) Name types of skin.

(3) What is Personality Development ?

(4) Name different areas of woman empowerment.

(5) Mention any three aspects of personal grooming.

(6) When did the Dowry Prohibition Act come into force ?
